



DR-16080001060603

Seat No. _____

B. Com. (Sem. VI) (CBCS) (W.E.F. 2016) Examination

April - 2022

Indirect Tax Law - 02

(GST-II)

(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

સૂચના : (૧) બધા પ્રશ્નોના જવાબ આપો.

(૨) દરેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવવામાં આવેલ છે.

૧ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું ? GSTની ગણતરી માટેની પ્રક્રિયા વિગતવાર સમજાવો. ૨૦

અથવા

૧ CGST, SGST અને IGST નું યોગ્ય ઉદાહરણ કાલ્પનિક આંકડા સાથે સમજાવો. ૨૦

૨ ટૂંકનોંધ લખો : (કોઈ પણ બે) ૨૦

(૧) ઇનપુટ ક્રેડિટ ટ્રાન્સફર

(૨) અતિરિક્ત ટેક્સ ક્રેડિટની પુનઃ પ્રાપ્તિ

(૩) મૂડી માલના સંદર્ભમાં ટેક્સ ક્રેડિટ

(૪) ખાસ સંજોગોમાં ટેક્સ ક્રેડિટની પ્રાપ્યતા.

૩ વિવિધ પ્રકારના GST રીટર્ન વિશે સમજૂતી આપો અને GST ઓડિટ પર નોંધ લખો. ૧૫

અથવા

૩ સ્વ મૂલ્યાંકન, ક્રેડિટ અને ડેબિટ નોટ પર વિગતવાર નોંધ લખો. ૧૫

૪ TDS અને TCS GST ના સંદર્ભમાં સમજાવો. ૧૫

અથવા

૪ નોંધ લખો : ૧૫

(૧) ટ્રાન્ઝેક્શન મૂલ્ય

(૨) મૂલ્યાંકન નિયમો.

ENGLISH VERSION

- Instructions :** (1) Give answer of all the questions.
(2) Figures on right side shown marks of each questions.

- 1 What is input tax credit ? Explain procedure for calculation of GST in detail. **20**

OR

- 1 Explain CGST, SGST and IGST with example in reference to imaginary figures. **20**

- 2 Write notes on : (any **two**) **20**

- (1) Transfer of input credit
- (2) Recovery of excess tax credit
- (3) Tax credit in respect of capital goods
- (4) Availability of tax credit in special circumstances.

- 3 Give explanation about different types of GST returns and write short note on GST audit. **15**

OR

- 3 Write a detail note on self assessment, credit and debit notes. **15**

- 4 Explain TDS and TCS with reference to GST. **15**

OR

- 4 Write notes on : **15**

- (1) Transaction value
- (2) Valuation rules.